

lanager: BNP Paribas Asset Management India Private Limited (AMC) porate Identity Number (CIN): U65991MH2003PTC142972

3NP Paribas House, 1 North Avenue, Maker Maxity, Bandra Kurla Complex, nbai - 400 051. Website: www.bnpparibasmf.in · Toll Free: 1800 102 2595

NOTICE CUM ADDENDUM NO. 41/2020

the Statement of Additional Information (SAI), Scheme Information Document Memorandum (KIM) for the Schemes of BNP Paribas Mutual Fund ('the Fund'):

al Points of Acceptance of Transactions (OPAT):

note the change in address of the following Official Points of Acceptance of Technologies Private Limited, Registrar & Transfer Agents:

Old Address	New Address	Effective date
er, CB-12, 2 nd Floor, Rail plex, Jammu - 180 012	304, A-1, 3 rd Floor, North Block, Bahu Plaza, Jammu - 180 004	October 19, 2020
ali Building, 1st Floor, Service, Opposite Asian wahati, Assam - 781 007	Ganapati Enclave, 4th Floor, Opposite Bora Service, Ullubari, Guwahati, Assam - 781 007	October 19, 2020
4, T Nagar, Rangachary ahmundry, East Godavari Idhra Pradesh - 533 101	No. 46-23-10/A, Tirumala Arcade, 2 nd Floor, Ganuga Veedhi, Danavaipeta, Rajahmundry, East Godavari District, Andhra Pradesh - 533 103	October 21, 2020

ndum forms an integral part of the SAI, SID & KIM of the Fund read with the addenda terms and conditions mentioned in the SAI, SID & KIM shall remain unchanged.

agement India Private Limited

IP Paribas Mutual Fund)

Date: October 17, 2020

Place: Mumbai ID INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,

Wealth sets you free

pon Life India Asset Management Limited

nerly known as Reliance Nippon Life Asset Management Limited)

ice: 4th Floor, Tower A, Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W),

that the Trustee of Nippon India Mutual Fund ("NIMF") has approved declaration of dividend

s. 10/- per unit in the undernoted scheme of NIMF, with October 23, 2020 as the record date:

013. Tel No. +91 022 6808 7000 • Fax No. +91 022 6808 7097 • www.nipponindiamf.com

(CIN - L65910MH1995PLC220793)

NOTICE NO. 72

L SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

on india Mutual Fund

DECLARATION



U.P. LIVESTOCK DEVELOPMENT BOARD

GOKARAN NATH ROAD, BADSHAH BAGH, LUCKNOW-226007, U.P., India Contact : (0522) 2977709, E-mail: upldb@rediffmail.com, http://upldb.up.gov.in

EOI No.: 437(2)-10/BC-SS/RGM/UPLDB/2019-20,

GLOBAL EXPRESSION OF INTEREST (EOI)

The Uttar Pradesh Livestock Development Board (U.P.L.D.B.), Department of Animal Husbandry, Government of Uttar Pradesh wishes to engage a Service Provider to create and run facilities to produce Sex Sorted/Sexed Semen from raw semen ejaculate harvested from Indigenous Bulls of Cattle Buffaloes to produce an minimum of 0.3 million gender specified sexed semen does (either X or Y bearing chromosome) per year at it's A grade Deep Frozen semen Station in Uttar Pradesh, India. Global Expression of Interest (EOI) is invited from all eligible service providers/agencies for execution of the project. Last date for submission of EOI on e-tender portal of Uttar Pradesh http://etender.up.nic.in will be 30.10.2020 at 11:00 AM, Detailed Terms of Reference (TOR) for Invitation of Expression of Interest (EOI) for Establishing facility for producing and supplying sex sorted/sexed semen of Indigenous, Crossbred and Buffalo breeds in UP is available on http://upldb.up.gov.in along with http://etender.up.nic.in. The participants who had earlier participated with respect to EOI no. 1349(1528)-Corri5(3)-10/BC-SS/RGM/UPLDB/2019-20, Dt. 06.03.2020 shall submit only the signed copy of the EOI documents uploaded against the present EOI on the e-tender portal, their earlier submitted documents will be considered forthis EOI also.

The terms and conditions should be read carefully and compiled with before submitting the EOI. Uttar Pradesh Livestock Development Board (UPLDB) reserves the right to (a) accept or reject any/all EOIs submitted by parties (b) cancel the process at any time without any liability and assigning any reason thereof. Any corrigendum hereafter shall be available at website http://upldb.up.gov.in along with state e-tender portal http://etender.up.nic.in

MUTUAL

Record Date

October 23, 2020

(Dr. Arvind Kumar Singh) Chief Executive Officer

Uttar Pradesh Livestock Development Board, Lucknow



CIN: L27104GJ1972PLC085827 Regd Office: 115-116, G.V.M.M. Estate. Odhav Road, Odhav, AHMEDABAD - 382 415 Website: www.welcaststeels.com Email: info@welcaststeels.com Phone: 079-22901078, Fax: 079-22901077

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, the 29th day of October 2020 through Video Conferencing, inter alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the Quarter and Half Year ended 30th September 2020.

This intimation is also available at the website of the Company www.welcaststeels.com arid also on the websites of Stock Exchange www.bseindia.com.

For Welcast Steels Limited

Date: 17.10.2020 Place: Ahmedabad

S. N. Jetheliya Company Secretary

APOLLO TRICOAT TUBES LIMITED CIN: 74900DL1983PLC014972

Registered Office: 37, Hargobind Enclave. Vikas Marg, Delhi-110092

Nippon india Mutual Fund

Wealth sets you free

MUTUAL

Nippon Life India Asset Management Limited

(formerly known as Reliance Nippon Life Asset Management Limited) (CIN-L65910MH1995PLC220793)

Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013. Tel No. +91 022 6808 7000 • Fax No. +91 022 6808 7097 • www.nipponindiamf.com

NOTICE NO. 73

Restoration of normal cut off timing of 3.00 p.m. in respect of certain schemes of Nippon India Mutual Fund

With reference to Notice No. 9 dated April 30, 2020 and communication from SEBI to AMFI (Reference no. SEBI/HO/IMD/DF2/OW/P/2020/17288/1) dated October 15, 2020 on restoration of normal cut off timing of 3.00 p.m. in respect of certain schemes, it has been decided that cut off timings for applicability of NAV for both subscription and redemption of all schemes other than those categorized as Debt schemes and Conservative Hybrid Fund as per SEBI circular dated October 06, 2017 on Categorization and Rationalization of Mutual Fund Schemes shall be restored to the original cut-off timings of 3.00 p.m. with effect from October 19, 2020.

For Debt Schemes and Conservative Hybrid Fund, the existing reduced cut off timings will be continued till further notice by RBI on the truncated market hours.

Accordingly effective October 19, 2020, the cut off timings for applicability of NAV of various categories of schemes shall be as mentioned below.

Sr. No.	Scheme Category	Cut off timings in case of Subscription	Cut off timings in case of Redemption
1	Liquid and Overnight Funds	12.30 p.m.	1.00 p.m.
2	Debt and Conservative Hybrid Fund, other than Liquid and Overnight Funds	1.00 p.m.	1.00 p.m.
3	All schemes other than those mentioned above at Sr. No. 1 & 2	3.00 p.m.	3.00 p.m.

All other provisions of various SEBI Circulars related to applicability of NAV in case of both subscription and redemption shall remain unchanged.

For NIPPON LIFE INDIA ASSET MANAGEMENT LIMITED

(formerly known as Reliance Nippon Life Asset Management Limited) (Asset Management Company for Nippon India Mutual Fund)

Mumbai

October 17, 2020

Authorised Signatory

Make even idle money work! Invest in Mutual Funds

Mutual Fund investments are subject to market risks. read all scheme related documents carefully.



CIN: U65921MH1995PLC212675

Regd. Office: 'Axis House', Ground Floor, C-2, Wadia International Centre, P.B.Marg, Worli, Mumbai - 400025 Tel.: 022-2425 2525, Email ID: info@axisfinance.in, Website: www.axisfinance.co.in

UNAUDITED FINANCIAL RESULTS FOR HALF YEAR ENDED 30 SEPTEMBER 2020

Control of the Contro	the state of the s	-
Half year ending	Corresponding half	Previo
0 September 2020	year ended	31 /

Particulars

ous vear ended

₹ in Lakhs)

March 2020

WELCAST STEELS

CIN: L27104GJ1972PLC085827

Read Office: 115-116, G.V.M.M. Estate

Odhav Road, Odhav. AHMEDABAD - 382 415

Website: www.welcaststeels.com

Email: info@welcaststeels.com

Phone: 079-22901078, Fax: 079-22901077

NOTICE

Notice is hereby given pursuant to Regulation

29 read with Regulation 47 of SEBI (Listing

Obligations and Disclosure Requirements

Regulations, 2015 that a Meeting of the

Board of Directors of the Company will be

held on Thursday, the 29th day of October

2020 through Video Conferencing, inte

alia, to consider, approve and take or

record the Unaudited Financial Results of

the Company for the Quarter and Half Year

This intimation is also available at the website

of the Company www.welcaststeels.con

ended 30th September 2020.

LIMITED

DATE: 17/10/2020

NOTICE FOR LOSS OF SHARE CERTIFICATES

Notice is hereby given that the Certificates in respect of the under mentioned Equity Shares of ou Company ("RMTL") / Amalgamated Company namely Ratnamani Engineering Limited ("REL" nave been lost / misplaced and the holder of the said Shares have applied to the Company fo ssue of duplicate share certificates in lieu thereof. Name of Folio No. of Certificate No(s). Distinctive No(s).

Shareholder(s) No(s). Shares From To From To 200 22149 – 22150 3814801 - 3815000

(REL) Any person having claim / objection in respect of the said shares, should communicate to the Company at the above mentioned Registered Office of the Company within 15 days from the date of this advertisement, else the Company will proceed to issue duplicate share certificate(s) after the expiry of 15 (Fifteen) days.

PLACE: AHMEDABAD

FOR, RATNAMANI METALS & TUBES LTD.

JIGAR SHAH JIGAR SHAH COMPANY SECRETARY

MOHIT INDUSTRIES LIMITED

CIN: L17119GJ1991PLC015074 Regd. office: 6th Floor, A-601/B, International Trade Centre, Majura Gate, Ring Road, Surat 395 002. (Gujarat) INDIA

Phone: +91-261-2463261, 2463262, 2463263, Fax: +91-261-2463264. Email: contact@mohitindustries.com Website: www.mohitindustries.com NOTICE

Notice is hereby given, pursuant to Regulation 29 read with 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that meeting of the Board of Directors of the company will be held on **Monday**, 26th October, 2020 at registered office of briedon's of the company will be field of immoray, 2stiff certiber, 2020 at registered office of the company to consider and approve Un-audited Financial Results of the company for the quarter and half year ended 30th September, 2020. This information is also available on the Company's website www.mohitindustries.com and on the website of the Stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com.

(Nikita Pediwal Place : SUBAT Date : 17/10/2020 Company Secretary

For MOHIT INDUSTRIES LIMITED

यूको बेंक 🚱 UCO BANK

(A Govt. of India Undertaking) HEAD OFFICE: 10, B.T.M. Sarani, Kolkata - 700 001

NOTICE

Pursuant to regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, NOTICE is hereby given that Board of Directors of the Bank will meet on 22nd October, 2020, inter alia, to consider and to take on record unaudited (reviewed) Financial Results of the Bank for the 2nd quarter and half year ended 30th September, 2020. The notice is also available at Bank's website (www.ucobank.com) and on websites of NSE and BSE.

Place : Kolkata Date: 16.10.2020

Honours Your Trust

Finance

General Manager

consolidated financial results

of the Bank for the quarter and half year ended 30th September 2020. MAHINDRA BANK LIMITED KOTAK

(E) kotak

KOTAK MAHINDRA BANK LIMITED

CIN - L65110MH1985PLC038137

Registered Office: 27BKC, C 27, G Block, Bandra Kurla Complex

Bandra (East), Mumbai - 400 051

Tel: 61660001, Website: www.kotak.com

NOTICE is hereby given that

Directors of the Bank will be held

on Monday, 26th October 2020

to consider and take on record

the unaudited standalone and

meeting of the Board of

Bina Chandarana Joint President &

October 17, 2020 Company Secretary

and also on the websites of Stock Exchange www.bseindia.com.
For Welcast Steels Limited Date: 17.10.2020 S. N. Jetheliya Company Secretar

Place: Ahmedabad

Union Mutual Fund Union Asset Management Company Private Limited

Investment Manager for Union Mutual Fund Corporate Identity Number (CIN): U65923MH2009PTC198201 Registered Office: Unit 503, 5th Floor, Leela Business Park,

Andheri Kurla Road, Andheri (East), Mumbai - 400059

• Toll Free No. 1800 2002 268/1800 5722 268; • Non Toll Free. 022-67483333

• Fax No: 022-67483401; • Website: www.unionmf.com; • Email: investorcare@unionmf.com

NOTICE CUM ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT (SID) AND KEY INFORMATION MEMORANDUM (KIM) OF DESIGNATED SCHEMES OF UNION MUTUAL FUND

Cut-off timings for applicability of Net Asset Value (NAV) for Schemes other than Debt Schemes of Union Mutual Fund restored to original timing of 3.00 p.m.

NOTICE is hereby given to the Unit holders, that pursuant to the SEBI communication dated October 15, 2020 read with the Notice cum Addendum dated April 07, 2020, Notice cum Addendum dated April 17, 2020 and Notice cum Addendum dated May 01, 2020 to the SID and KIM of the Schemes of Union Mutual Fund, the cut-off timings for applicability of NAV for all the Schemes of Union Mutual Fund other than the schemes categorized as Debt Schemes will be restored to the original cut-off timings of 3.00 p.m. as stated below, with effect from October 19, 2020:

Scheme(s)	Transaction Type	Existing cut-off time	Revised cut-off time
All Open-ended Schemes of Union	Subscription (including switch-in**)	1.00 p.m.	3.00 p.m.
Mutual Fund other than Debt Schemes	Redemption (including switch-out**)	1.00 p.m.	3.00 p.m.
**Investors are requested to note that, though the original cut-off timing of 3 p.m. will be restored for all open-ended Schemes other than			

Debt Schemes, the cut-off timing for applicability of NAV for switches between all open-ended Schemes other than Debt Schemes and Debt Schemes will be retained at 1 p.m. and will not change to 3 p.m. as stated above, till further notice. All other provisions relating to applicability of NAV for subscriptions/ redemptions/ switches mentioned in the SID and KIM of the

aforementioned Scheme(s) of Union Mutual Fund shall remain unchanged. The SID and KIM of the aforementioned Schemes of Union Mutual Fund will stand modified to the extent mentioned above.

This Addendum forms an integral part of the SID and KIM of the aforementioned Schemes of Union Mutual Fund.

All other terms and conditions of the SID and KIM of the aforementioned Schemes will remain unchanged.

For Schemes of Union Mutual Fund which are categorised as Debt Schemes, the cut-off timings for applicability of NAV as mentioned in the aforementioned Notice cum Addendum dated April 07, 2020 read with Notice cum Addendum dated April 17, 2020 and Notice cum Addendum dated May 01, 2020 will continue till further notice. The Schemes of Union Mutual Fund which are categorised as Debt Schemes are Union Liquid Fund, Union Corporate Bond Fund, Union Dynamic Bond Fund, Union Overnight Fund and Union Medium **Duration Fund.**

> For Union Asset Management Company Private Limited (Investment Manager for Union Mutual Fund)

Place: Mumbai Date: October 17, 2020

Authorised Signatory

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED **DOCUMENTS CAREFULLY.**

Statutory Details: Constitution: Union Mutual Fund has been set up as a Trust under the Indian Trusts Act, 1882; Sponsors: Union Bank of India and Dai-ichi Life Holdings, Inc; Trustee: Union Trustee Company Private Limited [Corporate Identity Number (CIN): U65923MH2009PTC198198], a company incorporated under the Companies Act, 1956 with a limited liability; Investment Manager: Union Asset Management Company Private Limited [Corporate Identity Number (CIN): U65923MH2009PTC198201], a company incorporated under the Companies Act, 1956 with a limited liability.

Copy of all Scheme Related Documents can be obtained from our website www.unionmf.com

NOTICE-CUM-ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT ('SID') AND KEY INFORMATION MEMORANDUM ('KIM') OF THE SCHEME(S) OF AXIS MUTUAL FUND ('THE FUND')

Revert to Normal Cut Off Timing for Specified Scheme(s)

ESSAR POWER (JHARKHAND) LIMITED

- In LIQUIDATION

U31101DL2005PLC211274

E-AUCTION SALE NOTICE

Sale of Assets

All assets of the under construction thermal power plant (2 x 600

MW) of Essar Power (Jharkhand) Limited, including movable and

immovable assets located at Tori, Dist. Latehar, Jharkhand and

movable assets located at Kolkata, will be put on sale by the

Liquidator (Huzefa Fakhri Sitabkhan) appointed by Hon'ble

National Company Law Tribunal, New Delhi, Principal Bench,

E-Auction on November 20, 2020 from 2 PM to 4 PM at web portal

Call at +91 88285 76197 or Email at epjl.lq@gmail.com for more

information. Detailed Sale notice uploaded on the website:

For Essar Power (Jharkhand) Limited - In Liquidation

huzefa.sitabkhan@gmail.com / epjl.lq@gmail.com

Huzefa Fakhri Sitabkhan

IBBI/IPA-001/IP-P00031/2017-18/10115

Liquidator

w.e.f. January 03, 2020

Date: October 19, 2020

Place: Mumbai

of: https://ncltauction.auctiontiger.net

https://ncltauction.auctiontiger.net

We refer to our notices dated April 06, 2020, April 17, 2020 and April 30, 2020 on change in cut-off timings for schemes of Axis Mutual Fund. Investors are requested to note that, pursuant to SEBI letter dated October 15, 2020, it has been decided that cut off timings for applicability of NAV for both subscription and redemption for all schemes other than those categorised as Debt Schemes [Debt Schemes shall include Debt Schemes, Conservative Hybrid Fund, Conservative Plan of Solution Oriented Scheme, Fund of Funds scheme investing in debt oriented Mutual Funds and shall exclude Liquid & Overnight schemes (hereinafter referred to as 'Debt Schemes')] as per SEBI Circular dated October 06, 2017 on Categorization and Rationalization of Mutual Fund Schemes shall be restored to the original cut-off timings of 3:00 p.m. with effect from October 19, 2020. For Debt Schemes the cut-off timings as mentioned in notice cum addendum dated April 06, 2020 shall be continued till further notice by RBI on the truncated market hours.

Further, in accordance with AMFI's communication dated October 17, 2020, it has also been decided to keep the cut-off timing for switch transactions from schemes (other than Debt Schemes) to Debt Schemes, Liquid and Overnight schemes as 1,00 p.m. This will be irrespective of the value of transaction, in order to maintain parity across all investors. To further clarify, any switch request from schemes (other than Debt Schemes) to Debt Schemes, Liquid and Overnight schemes received post 1.00 p.m. shall be processed on the next business day for both the schemes.

The relevant sections of SID and KIM of aforesaid scheme(s) shall stand modified in accordance with the above changes. All other terms & conditions of SID and KIM of the aforesaid scheme(s) of the Fund will remain unchanged.

This addendum forms an integral part of the SID and KIM of the aforesaid scheme(s) of the Fund. Investors are requested to kindly take note of the above.

> For Axis Asset Management Company Limited (CIN - U65991MH2009PLC189558) (Investment Manager to Axis Mutual Fund)

Place: Mumbai Date: October 18, 2020 No. : 31/2020-21

Sd/-Chandresh Kumar Nigam Managing Director & Chief Executive Officer

Statutory Details: Axis Mutual Fund has been established as a Trust under the Indian Trusts Act, 1882, sponsored by Axis Bank Ltd. (liability restricted to ₹ 1 Lakh). Trustee: Axis Mutual Fund Trustee Limited Investment Manager: Axis Asset Management Company Limited (the AMC) Risk Factors: Axis Bank Ltd. is not liable or responsible for any loss or shortfall resulting from the operation of the schemes. Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully



Axis House, First Floor, C2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025, India. TEL: (022) 4325-5161, FAX: (022) 4325-5199, EMAIL: customerservice@axismf.com, WEBSITE: www.axismf.com EASYCALL: 1800 221 322 ADDITIONAL CONTACT NUMBER: 8108622211

ઇન્ટેક કેપીટલ લીમીટેડ રજી.ઓફીસ:૭૦૮, મંજુશા બિલ્ડીંગ, ૫૭, નહેરૂ પેલેસ, નવી દિલ્હી-૧૧૦૦૧૯

પરિશિષ્ટ ૪(નિચમ ૮ (૧)કબજા નોટીસ માથી ઇન્ટેક કેપીટલ લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશ્ર અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એ એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪) હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનકોર્સમેન્ટ) નિયમો. ૨૦૦૨ નિયમ ૩) સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને તારીખ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ માંગણા નોટીસ જારી કરી દેવાદાર (૧)મેસર્સ કાશી પેક કેર(દેવાદાર

. (૨) જગદીશ રાણાભાઇ પટેલ (જામીનદાર/ગીરવેદાર) (૩) દયાબેન જગદીશભાઇ પટેલ (જામીનદાર) / (લોન એગ્રીમેન્ટ નં. LNAHM00114-150003888 તારીખ ૩૧.૦૫.૨૦૧૪) ને નોટીસમાં જણાવેલ ૨કમ રૂા.૪૨,૩૧,૩૬૭/- (રૂપિયા બેતાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો સડસઠ પુરા) જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદઃ ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર/જામીનદાર રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/ જામીનદા એ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એનફોર્સમેન્ટ નિયમો, ૨૦૦ ના નિયમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તે/તેણીને પ્રાપ્ત સત્તાન

ઉપયોગ કરીને નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો કબજો ૧૩ ઓક્ટોબર, ૨૦૨૦ ન રોજ મેળવી લીધો છે. ખાસ કરીને દેવાદાર / જામીનદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઇન્ટેક કેપીટલ લીમીટેડની ૨કમ ..૪૨,૩૧,૩૬૭/- (રૂપિયા બેતાલીસ લાખએકત્રીલ હજાર ત્રણસો સડસઠ પુરા ૩૧.૧૨.૨૦૧૯ મુજબ અને વ્યાજ અને સંપુર્ણ ચુકવણી સુધી તેના પરના ખર્ચને આધિન રહેશે

સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય મર્યાદાના સબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે તમારૂ ધ્યાન દોરવામાં આવે છે. રથાવર મિલકતની વિગત ફલેટ નં./૧૦૬, સી-૧ ટાઇપ, પહેલો માળ ક્ષેત્રફળ ૯૦.૧૦ ચો.મી. (કોમન રોડ અને કોમન

૨૮૯/૨, (ફ્રાઇનલ પ્લોટ નં. ૯૩/૧, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં.૧૦૩)અને સર્વે નં. ૨૯૦/૧ (ફાઇનલ પ્લોટ નં. ૯૩/૨, પીઆરએસ ૧૦૩) મોજે નિકોલ, તાલુકો સીટી, રજીસ્ટ્રેશન િ સ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ ખોત આવેલ રેસીડેન્સીયલ/કોર્મસીયલ પ્રોપર્ટી જમીન/ બિલ્ડીંગ/ સ્ટ્રક્ચ અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા. દ્રાન્ટેક કેપિટલ

MAGNUM VENTURES LIMITED

CIN: L21093DL1980PLC010492

Regd. Office: Office No. 205, 2nd Floor, Building No. 4326 Street No. 3, Ansari Road Darya Ganj, New Delhi - 110002

Tel: 0120-4199200 Fax: 0120-4199234

In view of the continuing Covid-19 Pandemic, the Ministry of Corporate Affairs (MCA) has vide its circular dated May 5, 2020 read with circulars dated April 8, 2020 & circular dated

April, 13th 2020 permitted the holding of AGM through Video Conference or Other Audio-Visual Means (OAVM). In compliance with these Circulars and the relevant provisions of

the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the upcoming AGM of the Company will be held on November 10th, 2020 at 11:00 a.m. through VC/OAVM.

As per aforesaid circulars, the Notice of AGM along with the Annual Report for FY 2019 2020 has to be sent only by electronic mode to those Members whose E-mail Id are already

registered with the Company/ Depositaries. The Company is also providing e-voting and

If your email ID is already registered with the Company/ Depositary, Notice of AGM along with annual report for FY 2019-2020 and login details for e-voting shall be sent to your registered email address. In case you have not registered your email ID with the Company/ Depositary, please follow below instructions to register your email ID for obtaining Annual Peopotic FX 2010 2020 conclusive the tips for experience.

Send a request to Registrar and Transfer Agents of the Company, MAS

Services Limited at info@masserv.com providing Folio number, Name of the

shareholder, scanned copy of the share certificate (Front and Back), PAN(

Self attested scanned copy of PAN Card), AADHAR (Self attested scanned

Please send your bank detail with original cancelled cheque to our RTA (i.e

MAS Services Limited, T-34 2nd floor, Okhla industrial area phse-ii, New Delh

Please contact your Depositary Participant (DP) and register your emai

Please also update your bank detail with your DP for dividend payment b

10020 alongwith letter mentioning folio no. if not registered already.)

PLEASE UPDATE THE SAME ON OR BEFORE 19/10/2020

PLEASE UPDATÉ THE SAME ON OR BEFORE 19/10/2020

The Notice of AGM and Annual Report for FY 2019-2020 will also be available on

Company's website @ www.magnumventures.in and website of BSE Limited at

www.bseindia.com. Members attending the meeting through VC/ OAVM shall be counted

emote e-voting facility to all its Members similar to earlier practices

copy of Aadhar Card) for registering email address.

address as per the process advised by DP.

for the purpose of Quorum under Section 103 of the Companies Act, 2013.

NACH if declare by company.

Holding

Report for FY 2019-2020 and login details for e-voting

E-mail: magnumventures@gmail.com Website: www.magnumventures.ir

પેસેજ અને જમીનનો ન વહેચાયેલ હિસ્સો) ક્રિષ રેસીડેન્સી તરીકે જાણીતી સ્કીમમાં, સર્વે નં

સ્થળ : નહેરુ પેલેસ, નવી દિલ્હી

બજાજ ફાચનાન્સ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : મુંબઇ-પુના રોડ, અકુરડી, પુને, મહારાષ્ટ્રા-૪૧૧૦૩૫. શાખા ઓફીસ : ત્રીજો માળ, ૩૦૧ કે પી ટાવર દમણ સિલવાસા રોક, અલ્હાબાદ બેંક આગળ, વાપી ઇસ્ટ વાપી ગુજરાત-૩૯૬૧૯૧ કબજા નોટીસ

સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૪) હેઠળ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨નો નિયમ ૮ (૧). (પરિશિષ્ટ ૪) જત જણાવવાનું કે મેસર્સ બજાજ ફાચનાન્સ લીમીટેડ (બીએફએલ)ના નીચે સહી કરનાર અધિકૃત અધિકૃત્તિએ સિક્યોરીટાઇ)જ્ઞન અને રીકન્સ્ટ્રફ્શન ઓફ ફાચનાન્સિચલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ

એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામાનદાર(રો)ને સદરહ નોટીસમાં જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી દ્દું દિવસની અંદર નોટીસમાં જણાવેલ રકમ ચુકવી જવા મા માંગણા નોટીસ જારી કરી હતી. દેવાદાર(૨))સહ–દેવાદારો/જમીનદાર(૨)) રકમની પુનંચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે, પરિણામે દેવાદાર(૨))સહ–દેવાદારો/જમીનદાર(૨))અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે મેસર્સ બજાજ ફાચનાન્સ લીમીટેડના વતી નીચે સહી કરેનારે સદરહુ નિયમોના નિયમ ૮ે(૧) સાથે વંચાતા સદરહુ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ તાલું કરવા સાર્યા કરવામાં આવે છે. પરિણામે ખાસ કરીને દેવાદાર(સ)/સહ–દેવાદાર)/જામીનદાર(સ) અને જાહેર જનાતાને નીચે જણાવેલ મિલક્ત સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલક્ત સાથેનો કોઇપણ સોદો બીએફએલની અહીં જણાવેલ રકમ(મો) અને તેના પરન ચડત વ્યાજના પ્રથમ સાર્જને આદિાન રહેશે.

દેવાદાર(રો)/જામીનદાર(રો)નું નામ	સિક્યોર્ડ એસેટની વિગત	માંગણા નોટીસની	કબજાની
(લોન એકાઉન્ટ નં, શાખાનું નામ)	(સ્થાવર મિલકત)	તારીખ અને રકમ	તારીખ
શાખા : વાપી/ગુજરાત	નીરોની વિગતમાં જણાવેલ બિન ખેતીલાયક	२६.०२.२०२०	૧૪
(લોન નં. ૫૮૪એલએપી૦૨૫૮૬૬૯૩)	મિલકતોના તમામ ભાગ અને હિસ્સા:		ઓક્ટોબર,
દેવાદારો : / સહ-દેવાદારો	ઓફીસ નં. ૧ અને ૨, બીજો માળ ચમુના કોમ્પલેક્ષ	રૂા. ૭૦,૪૪,૫૫૨/–	5050
૧. કાંતિ કરસન પટેલ (દેવાદાર)	પ્લોટ નં. ડી.૧ રેવન્થૂ સર્વે નં. ૨૭૮/એ/૩, સિટી સર્વે	(રૂપિયા સીત્તેર લાખ	
2. ભાવના . કે પટેલ	નં. ૧૧/૧૩૬, નેશનલ હાઇવે નં. ૮ વાપી જિલો–	ચુમ્માલીસ હજાર	
સહ દેવાદાર	વલસાડ-૩૯૬૧૯૧	પાંચસો બાવન પુરા)	
બંનેનું સરનામું : ફલેટ નં. ૨૦૫,જલદ્યામ	ચતુઃસીમા :-	,	
એપાર્ટમેન્ટ, જમનાનગર, જલારામ મંદિર રોડ,	ઉત્તર : ખુલી જગ્યા,		
· · · · · ·	દક્ષિણ : ઓફીસ નં. ૨,		
નેશનલ હાઇવે નં. ૮ વાપી–૩૯૬૧૯૧	પુર્વ : ફ્લેટ નં. ૨૦૧ અને પેસેજ		
	પશ્ચિમ : પેસેજ અને ખુલી જગ્ચા		
સ્થળ : વાપી /ગુજરાત	1	ોસર્સ બજાજ ફાયનાન્સ	
તારીખ : ૧૯.૧૦.૨૦૨૦		(નિલેષ પટેલ), અધિ	કૃત અદિકારી

SAMASTA MICROFINANCE LIMITED

CIN: U65191KA1995PLC057884 Registered Office: No.110/3, Lalbagh Main Road, Krishnappa Layout, Bangalore - 560027. Website: www.samasta.co.in, Tel: 080 4291 3500

Statement of Standalone Financials Results for the Half Year ended September 30, 2020 Rs. **Particulars** ember 30,2020 Sep.30 .2019 March 31.2020 March 31.2019 Unaudited Unaudited Audited 2,95,36,52,896 **Total Income from Operations** 2,63,39,34,672 5,74,82,46,402 3,33,65,21,90 Net Profit / (Loss) for the period (before Tax 40,52,73,613 83,62,80,271 1,43,43,18,913 72,43,06,06 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 40,52,73,613 83,62,80,271 1,43,43,18,913 72,43,06,068 Net Profit / (Loss) for the period after tax 32,37,96,947 60,54,21,440 1,07,30,35,324 53,20,91,679 (after Exceptional andor Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (afte 32.79.29.611 60.33.46.440 1.06.80.24.587 52.77.33.29 tax) and Other Comprehensive Income (after tax)] 2,64,24,51,400 2,07,74,79,660 2,64,24,51,400 1,78,03,91,130 Paid up Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) 2,77,70,32,105 1,69,16,49,277 2,44,91,02,494 88,53,91,371 5,41,94,83,505 3,76,91,28,937 5,09,15,53,894 2,66,57,82,50 9 Paid up Debt Capital / Outstanding Debt 27.94% 40.85% 28.75% 37.749 10 Outstanding Redeemable Preference Shares 4.79 3.95 6.20 3.81 11 Debt Equity Ratio 12 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1.23 3.39 5.47 3.86 2. Diluted 13 Capital Redemption Reserve 14 Debenture Redemption Reserve NA NA NA NA 15 Debt Service Coverage Ratio 16 Interest Service Coverage Ratio NA NA NA NA

Date: October 16, 2020

Place: Bangalore

By order of the Board For Samasta Microfinance Limited Sd/-

Venkatesh. N **Managing Director** DIN: 01018821

રજીસ્ટર્ડ ઓફીસ : મુંબઇ-પુના રોડ, અકુરડી, પુને, મહારાષ્ટ્રા–૪૧૧૦૩૫. શાખા ઓફીસ : ૪૦૪ થી ૪૦૬, ચોથો માળ, ટ્રિનેટી બિઝનેસ પાર્ક, એલ.પી. સવાણી રોડ, સુરત, ગુજરાત–૩૯૫૦૦૪ કબજા નોટીસ

બજાજ ફાચનાન્સ લીમીટેડ

સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૪) હેઠળ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨નો નિયમ ૮ (૧). (પરિશિષ્ટ ૪)

૪ત જણાવવાનું કે મેસર્સ બજાજ ફાચનાન્સ લીમીટેડ (બીએફએલ)ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામાનદાર(રો)ને સદરહુ નોટીસમાં જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી દૃ૦ દિવસની અંદર નોટીસમાં જણાવેલ રકમ ચુકવી જવા માટે માંગણા નોટીસ જારી કરી હતી. દેવાદાર(૨))સહ–દેવાદારો/જામીનદાર(૨)) રકમની પુર્નચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે, પરિણામે દેવાદાર(૨))સહ–દેવાદારો/જામીનદાર(૨))અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે મેસર્સ બજાજ ફાચનાન્સ લીમીટેડના વતી નીચે સહી કરનારે સદરહુ નિયમોના નિયમ ૮(૧) સાથે વંચાતા સદરહુ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો મેંળવી લીધો છે. પરિણામે ખાસ કરીને દેવાદાર(રો)/સહ–દેવાદારો/જામીનદાર(રો) અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકત સાથેનો કોઇપણ સોદો બીએ કએલની અહીં જણાવેલ રકમ(મો) અને તેના પરન ચડત વ્યાજના પ્રથમ ચાર્જને આદિાન રહેશે.

દેવાદાર(રો)/જામીનદાર(રો)નું નામ	સિક્ચોર્ડ એસેટની વિગત	માંગણા નોટીસની	કબજાની
(લોન એકાઉન્ટ નં, શાખાનું નામ)	(સ્થાવર મિલકત)	તારીખ અને રકમ	તારીખ
શાખા : સુરત	નીરોની વિગતમાં જણાવેલ બિન ખેતીલાયક	95.05.5050	૧૩
(લોન નં. ૪૨૮એલએપીઇઇ૪૦૫૦૭૦)	મિલકતોના તમામ ભાગ અને હિસ્સા:		ઓક્ટોબર.
(લાંન ન. કરટઅલઅપાઇકઠવવડડ) દેવાદારો : / સહ–દેવાદારો ૧. પંકજકુમાર પટેલ (દેવાદાર) (અવસાન પછી કાનુની વારસદાર વતી) ૨. સાવિત્રીબેન પટેલ (સહ–દેવાદાર) બંનેનું સરનામું : ફ્લેટ નં. ૮૦૪, આઠમો માળ, સી ટાવર, સૂર્ચા પ્લાઝા, જીવન ભારતી સ્કુલની બાબુમાં, ઉદ્યના, મગદદ્યા રોડ ભાતર સુરત-૩૯૫૦૦૪.	"ફ્લેટ નં. ૮૦૭, આઠમો માળ, સી ટાવર, સૂર્યો પ્લાઝા, જીવન ભારતી સ્ફુલની બાજુમાં, ઉદ્યના મગદલા રોડ ભાતર સુરત-૩૯૫૦૦૭." ચતુઃસીમા :- ઉત્તર : ફ્લેટ નં. ૮૦૯,	રૂા. ૫૬,સ્ટ,૮૧૮/– (રૂપિશા છપ્પન લાખ અઠ્યાવીસ હજાર આઠસો અઢાર પુરા)	5050
સ્થળ : સુરત તારીખ : ૧૯.૧૦.૨૦૨૦		બિજાજ ફાયનાન્સ (નેલેષ પટેલ). અધિક	

ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેડ રજીસ્ટર્ડ ઓફીસ : પાંચમો માળ, ૧૫૮ દાની કોર્પોરેટ પાર્ક, સી.એસ.ટી. રોડ, કલિના, ાક્રુઝ (ઇસ્ટ), મુંબઇ–૪૦૦૦૯૮

સરફૈસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ માંગણા નોટીસ

મો, નીચે જણાવેલ દેવાદાર, સહ-દેવાદારોએ તમારી વધુમાં ખાર્સ કરીને નીચે જણાવેલ સ્થાવર મિલકતો (સિક્યોરીટી) ના ગીરો દ્વારા બેંક / નાણાંકિય સંસ્થાઓ પાસેથી લોન/નોન સવલત (સવલતો) મેળવી છે. તમારા કસુરના પરિણામે, તમારા લોન એકાઉન્ટો નોન પરફોમિંગ એસેટો તરીકે વર્ગીકૃત કરાયા હતાં અને પછી નીચે જણાવેલ સોંપણીઓના અલગ્ ઊંડો દ્વારા તે ફોનિક્સ આર્ક પ્રાઇવેટ લીમીટેડ (નીચે જણાવેલ સંબંધિત ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે કાર્યરત) ની તરફેણમાં તેની વસુલાત માટે સ્થાવર મિલકતો અંગે સર્જાયેલ નીચે દર્શાવેલ સેક્ચોરીટી ઇન્ટરેસ્ટ સહીત જણાવેલ લોન(નો) પ્રાપ્ત કરવા માટે તમારા દ્વારા કરાયેલ દસ્તાવેજો મુજબ તમારા પાસેથી મળવાપાત્ર તમામ હકો, ટાઇટલ, હિતો, લાભો , બાકી રકમ ક્ષહીત સોંપવામાં આવેલ છે. ફોનિક્સ આર્કે જણાવેલ સોંપણીઓ અન્વયે અને બાકી રકમની વસુલાત માટે સિક્યોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અં એન કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (એક્ટ)ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ જારી કરી હતી. જેની વિગતો સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ)નિયમે ૨૦૦૨ ના નિયમ ૩(૧)સાથે વંચાતી એક્ટની કલમ ૧૩(૨) મુજબ પ્રસિદ્ધ કરીને તમને તેની બજવણી કરાઇ રહી છે.

ર્તોપણીની તારીખ, ટ્રસ્ટો, દેવાઘર, સહ-દેવાઘર, ગીરો મિલકતો, બાકી રકમોની વિગતો, કલમ ૧૩(૨) હેઠળની માંગણા નોટીસ અને તે હેઠળની ઘવાની રકમ નીચે મુજબ દેવાદાર, સહ-દેવાદાર/ જામીનદારનું નામ અને સરનામું, લોન એકાઉન્ટ નંબર, લોનની રકમ સિક્ચોરિટીની વિગતો વ. ધિરાણકર્તાનું નામ ૨. એસાઇમેન્ટની તારીખ 3. ટ્રસ્ટની વિગત ૪. માંગણા નોટીસની તારીખ ૫. બાકી રકમ શ્રી હસ્તીમલ ચતુરદાસ વૈષ્ણવ, શ્રી હસ્તીમલ વૈષ્ણવ, શ્રી ઉમંગ ટી ડેપો ફ્લેટ નં. એ૭-૪૦૩, ચોથો ૧) બજાજ ફાયનાન્સ લીમીટેડ (બીએચએફએલ)

માને શ્રીમતી મમતા વૈષ્ણત તમામનું સરનામું : ઉમેગ ટી ડેપો, હરિદર્શન કોસ તોડ પાસે, ન્યુ નરોડા, અમદાવાદ, ગુજરાત. અહીં પણ : બ્લોક એ હ/૪૦૩, વામીનારાચણ પાર્ક શ્રી રામ કુટીર સામે, અમદાવાદ, ગુજરાત-૩૮૨૩૩૦, તોન એકાઉન્ટ નાં : 4180HL52886825 & 4180HL52899145 હેસ્તીમલ ચતુરદાસ ચૈથાવ હેસ્તીમલ ચતુરદાસ ચૈથાવ હેસ્તીમલ ચતુરદાસ ચૈથાવ હસ્તીમલ ચતુરદાસ ચૈથાવ વસુતાત સુધીના ખર્ચ અને ચાર્જસહેત રોડ પાસે, ન્યુ નરોડા, અમદાવાદ, ગુજરાત. **અહીં પણ** : બ્લોક એ ૭/૪૦૩, સ્વામીનારાયણ પાર્ક શ્રી રામ કુટીર સામે, અમદાવાદ, ગુજરાત–૩૮૨૩૩૦, લોન એકાઉન્ટ નં : 4180HL52886825 & 4180HL52899145 મંજુર કરેલ લોનની રકમ : રૂા. ૧૮,૦૦,૦૦૦/- (રૂપિયા અઢાર લાખ પુરા) મેરાસે કંટ્રોલ કાચનેમિકના સીધા પ્રોપરાઇટર શ્રી અલ્પેશકુમાર પ્રજાપતી વતી, શ્રી અલ્પેશકુમાર પ્રજાપતી અને શ્રીમતી કલ્પનાબેન પ્રજાપતી તમામનું સરનામું : પ્લીટ નં. ૧૦૦૨ પટેલ ઓટો સામે ગર્ગમુક્તી રોકડી જીઆઇરીસી, અંકલેક્ષર, ગુજરાત–3૯૩૦૦૧. **અહીં પ**ણ : ક્લેટ નં. એ-3૦૩, ત્રીજો માળ, વિંગ એ, શિવમ કો.ઓ.હા.સો.લી., સેગ્ટ મેરી સ્કુલ સામે, સાણોદ કોલોની, તિંગ એ, શિવમ કો.ઓ.હા.સો.લી., સેગ્ટ મેરી સ્કુલ સામે, સાણોદ કોલોની, તિંચ સાર્ટી, જિલ્લાન સાંગ્રેસ ક્લામ તે કરમ કર્યા વધુમાર પ્રજાપતી સાથે ક્લેટ મારે કર્યા સાથે કર્યા સાથે કરો કર્યા સાથે સાથે કર્યા સાથે ક

શ્રી માણેકભાઇ બી. સુકલેચા, શ્રીમતી સંગીતાબેન સુકલેચા અને **શ્રી રતનભાઇ સુકલેંચા તમામનું સરનામું** : ડી ૭૦૩ દાદા ભગવાન, ોમ્પલેક્ષ, નવાગામ કામરેજ, ગુજરાત–૩૯૪૧૮૫. **અહીં પણ** : શ્રી માણેકભાઇ બી. સુકલેચા રિરિદ્ધ સિરિદ્ધ મોબાઇલ એન્ડ નોવેલ્ટી બ્લોક

ાં. ૧૪૮, શોપ નં. જી ૧૨, ફોર્સ્યુન ગુજરાત, કામરેજ, ગુજરાત--૪૧૮૫. **લોન એકાઉન્ટ નં :** 4Z8RSE47312655 **મંજુર કરેલ** ફ્લેટ નં. ૩૦૧, વિનાચક એપાર્ટમેન્ટ, ખાંડેરાવ માર્કેટ સામે,

ભાગ-બી, બરોડા, ગુજરાત-૩૯૦૦૦૧. **અહીં પણ :** ટીએફ-૩૦૪ ગજાનંદ એવન્યુ, બહેરામપુરા, બરોડા, ગુજરાત-૩૯૦૦૦૧. **લોન** મેકાઉન્ટ નં : 413CHS00819791મંજુર કરેલ લોનની રકમ : ા. ૧૩,૧૪,૦૦૦/– (રૂપિયા તેર લાખ ચૌદ હંજાર પુરા) **શ્રી મનિષ કડિયા તમામનું સરનામું** : સન ફાર્મા

વડોદરા હાલોલ હાઇવે, બરોડા, ગુજરાત**. અહીં પણ** : બી ૨૧/૧ શિવમ ડુપ્લેક્ષ કર્મચોગી સ્કુલ પાસે, વાઘોડિયા રોડ ારોડા. ગજરાત-૩૯૦૦૧૯. **લોન એકાઉન્ટ નં** : 13SHO33446876, 413SHO33454835 & 413SHO35579060 **મંજુર કરેલ લોનની રકમ** : રૂા. ૨૩,૬૧,૯૨૯/– (રૂપિયા શ્રેવીસ લાખ એક્સઠ હજાર નવસો ઓગણત્રીસ પુરા)

લેબોરેટરીઝ લીમીટેડ સન ફાર્મા લેબોરેટરીઝ લીમીટેડ

સિટી સર્વે નં. ૨૮૬૦ જુની પ્રોપર્ટી નં. ૧૮૮૪ ૧) બજાજ ફાયનાન્સ લીમીટેડ ાસતા તવા ન. ૨૯૬૦ જુના પ્રાપતા ન. ૧૮૮૪ ૧) બજાજ ફાયનાસ્ત લામાટડ નવી પ્રોપાર્ટી નં. ૧૮૬૦, શોપ નં. ૧૫, શક્તિ (બીએચએકે-એલ) ૨) રફ. ૧૨.૨૦૧૯ ૩) કોમ્પાલેસ દેના બેંક સામે, કાદોદ, તાલુકો-બારડોલી, જિલો–સુરત-૩૯૪૩૨૫ ના પીસ અને પાસંલ. **ગીરવેદારનું નામ** : શ્રી માણેકભાઇ સુકલેસા, શ્રીમતી સંગીતાબેન (૦૧,૦૯.૨૦૨૦ થી લાગુ સડત ત્યાજ તેમજ મહતેઆ અને શ્રી ગુનનભાઇ સહતેઓ માંગા દાસાવા સ્ક્રીનો માર્ગ અને આઈસ્તો પ્રસ્તે છે.

લોનની રકમ : રૂ. ૭,૮૦,૦૦૦/– (રૂપિયા સાત લાખ એંસી હેજાર પુરા) | સુકલેસા અને શ્રી રતનભાઇ સુકલેસા સંપુર્ણ વસુલાત સુધીના ખર્ચ અને ચાર્જ સહીત **શ્રી સંજય રામચંદ્ર કદમ અને શ્રીમતી સોનલ કદમ તમામનું સરનામું** ફિલેટ નં. ૩૦૧, વિનાયક એપાર્ટમેન્ટ, ૧) બજજ ફાયનાન્સ લીમીટેડ (બીએચએફએલ ખાંડેરાવ માર્કેટ સામે, વિભાગ-બી, ટિક્કા ન ૧૩/૬ સિટી સર્વે નં . ૮૨, વડોદરા શહેર, બાબજીયુરા, વિભાગ બરોડા-૩૯૦૦૦ ઓગાણત્રીસ પુરા) ૧૯.૦૮.૨૦૨૦ ની બાકી અને

ના પીસ અને પાસંલ**. ગીરવેદારનું નામ**ં યુકલતાપાસ, ૧૯૦, ૧૦૦, ૨૦૦ ના બાકી અને વા પીસ અને પાસંલ. **ગીરવેદારનું નામ**ં યુકલતાપાસ, ૧૦૦, ૦૦, ૨૦૦ ના બાકી અને શ્રી સંજય કદમ અને શ્રીમતી સોનલ કદમ તેમજ સંપુર્ણ વસુલાત સુધીના ખર્ચ અને ચાર્જસહી સાત પંચા કરને રાળ સાનતા તાલાત કરન નિ તમજ સપુવા તલુવાત તુવાના પત અને વાજ સહાત હોં. તે હોં. તે

ગીરવેદારનું નામ : શ્રી મનિષ પ્રવિણભાઇ કડિયા. વસુલાત સુધીના ખર્ચ અને ચાર્જ સહીત . રિણામે તમો દેવાદાર અને સહ-દેવાદારો/જામીનદારોને ઉપર જણાવેલ માંગણાની ૨કમ ઉપર જણાવેલ ચડત વ્યાજ સહીત આ નોટીસના ૬૦ દિવસની અંદર સંપુર્ણપણે ચુકવવા જણાવ્ હતું, જેમાં નિષ્ફળ જતાં નીચે સહી કરનારને ઉપર જણાવેલ સિક્યોરીટીને ટાંચમાં લેવા માટે એક્ટ હેઠળ પગલા લેવાની ફરજ પડશે. એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇએ

ાત્વે તમારૂ ધ્યાન દોરવામાં આવે છે જે હેઠળ તમો સદરહું જોગવાઇઓમાં જણાવેલ ગાળા દરમિયાન સિક્યો ર્ડ એસેટ પરત મેળવવા સ્વતંત્ર છો. નોંધ લેવી કે જણાવેલ કાયદાની કલમ ૧૩(૧૩) કેઠળ તમને અમારી મંજૂરી વગર વેચાણ, ભાડે અથવા અન્ય રીતે ઉપર જણાવેલ સિક્યોરીટીને તબદીલ કરવા મનાઇ ફરમાવામાં આવે છે.

સ્થળ : ગુજરાત તારીખ : ૧૯.૧૦.૨૦૨૦ ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેડ વતી, અધિકૃત અધિકારી

For Magnum Ventures Limited Place: Ghaziabad Pardeep Kumar Jain Date: 16.10.2020 Managing Director